

શુલ્કનું સમયપત્રક - સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ

(ઉત્પાદન હવે બંધ થઈ ગયું છે)

સરેરાશ માસિક બેલેન્સ (AMB)	
સરેરાશ માસિક બેલેન્સ	મેટ્રો, શહેરી શાખાઓમાં ₹૧૦,૦૦૦/- અર્ધ-શહેરી શાખાઓમાં ₹૫,૦૦૦/- ગ્રામીણ શાખાઓમાં ₹૨,૫૦૦/-
AMB લિન-જાળવણી શુલ્ક	ગ્રેઈ શુલ્ક લાગુ પડતું નથી
રેમિટી એકાઉન્ટ્સ અથવા બિઝનેસ એકાઉન્ટ્સ સાથે સુવિંન	
ક્રંટ એકાઉન્ટ સુવિંન	ઉચ્ચ મૂલ્યના ક્રંટ એકાઉન્ટમાં સુપ ક્રી શકાય છે
સેવિંગ્સ એકાઉન્ટ સુવિંન	ઉચ્ચ મૂલ્યના સેવિંગ્સ એકાઉન્ટમાં સુપ ક્રી શકાય છે
ચેક બુક (૨૫ લીફની કમ્બ ચેક બુક) મર્યાદા	દર છ મહિનામાં ૧ ચેક બુક મફત
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક	પ્રતિ લીફ રૂ. ૩૫૫
ઉધારાણી	
સ્થાનિક ચેક ક્રિયાર્થિન	મફત
બેંક ખાતે અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	રૂ. ૫૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૨૫, રૂ. ૫૦૦૦ થી વધુ અને રૂ. ૧૦,૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૫૦/-, રૂ. ૧૦,૦૦૦ થી વધુ અને રૂ. ૧૦૦૦૦૦ સુધીનું શુલ્ક રૂ. ૧૦૦/-, રૂ. ૧૦૦૦૦૦ થી વધુનું શુલ્ક રૂ. ૧૫૦/-
બેંક સિવાયના સ્થાન પર અન્ય બેંકના ચેક ક્રેડિટશનનું શુલ્ક	
RTGS ઇનવર્ડ/NEFT ઇનવર્ડ/IMPS ઇનવર્ડ	મફત
ફોરેન ઇનવર્ડ રેમિટન્સ	મફત
ચુકવણી	
શાખાએ ડિમાન્ડ ડ્રાફ્ટ અને પેઓર્ડર	દર મહિને ૩ કીલો સુધી મફત
મફત મર્યાદા પછી શુલ્ક (જો બેંકમાં સહી અપડેટ કરવામાં આવી હોય તો જ)	પ્રતિ કીલો રૂ. ૫૦
શાખા સિવાયના સ્થળોએ ડિમાન્ડ ડ્રાફ્ટ (જો બેંકમાં સહી અપડેટ કરવામાં આવી હોય તો જ)	પ્રતિ કીલો રૂ. ૧૦૦
PAP ચેક વડે ચુકવણી	મફત
શાખામાં RTGS અને NEFT આઉટવર્ડ (મફત ઓનલાઈન)	NEFT: રૂ. ૧૦૦૦/- સુધી રૂ. ૨.૨૫, રૂ. ૧૦૦૦ થી રૂ. ૧૦૦૦૦૦ સુધી: રૂ. ૪.૫, રૂ. ૧૦૦૦૦૧ થી રૂ. ૨૦૦૦૦૦ સુધી: રૂ. ૧૪.૫, રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦૦ સુધી: રૂ. ૨૪.૫. RTGS: રૂ. ૨૦૦૦૦૦ થી રૂ. ૫૦૦૦૦૦ સુધી: રૂ. ૨૦, રૂ. ૫૦૦૦૦૦ થી વધુ: રૂ. ૪૦.
IMPS આઉટવર્ડ (લિસ ટીક મર્યાદા રૂ. ૫,૦૦,૦૦૦/-)	
રોક શુલ્ક	
રહેણાં સ્થાને રોક જમા (એટીએમ અને શાખા સહિત)	પ્રતિ મહિને રૂ. ૧,૦૦,૦૦૦ સુધી મફત.
રહેણાં સ્થાને રોક જમા (એટીએમ અને શાખા સહિત)	શૂન્ય
મફત મર્યાદાથી વધુ પર શુલ્ક (રહેણાં શાખા અને લિન-રહેણાં શાખા)	રૂ. ૫/૧૦૦૦
રહેણાં સ્થાને રોક ઉપાડ	ઉત્પાદન
લિન-રહેણાં સ્થાને રોક ઉપાડ	રૂ. ૪/૧૦૦૦
ઈન્વિટાસ બેંકના તમામ એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને લિન-નાણાકીય વ્યવહારો સહીત)	મફત અમર્યાદિત
મેટ્રો સ્થાને અન્ય બેંકના એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને લિન-નાણાકીય વ્યવહારો સહીત)	૩ વ્યવહારો
નોન-મેટ્રો સ્થાને અન્ય બેંક એટીએમ પર ડેબિટ કાર્ડ વડે વ્યવહારો (નાણાકીય અને લિન-નાણાકીય વ્યવહારો સહીત)	૫ વ્યવહારો
મુક્ત મર્યાદાથી વધુના નાણાકીય વ્યવહારો પર શુલ્ક*	રૂ. ૨૩ પ્રતિ વ્યવહાર
મુક્ત મર્યાદાથી વધુના લિન-નાણાકીય વ્યવહારો પર શુલ્ક	રૂ. ૧૨ પ્રતિ વ્યવહાર
નોન-ઈન્વિટાસ એટીએમનો ઉપયોગ - અપૂરતા ભંડોળને કારણે રોક ઉપાડ નક્કી	રૂ. ૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર રોક ઉપાડ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૧૧૦ પ્રતિ વ્યવહાર
ભારતની બહાર બેલેન્સની પૂછપરછ (માત્ર આંતરરાષ્ટ્રીય કાર્ડ માટે)	રૂ. ૨૫ પ્રતિ વ્યવહાર
અન્ય શુલ્ક	
વિઝા / રૂપે ક્રાસિક ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકાણ મોડેલ શુલ્ક)	રૂ. ૧૯૯
વિઝા ગોલ્ડ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકાણ મોડેલ શુલ્ક)	રૂ. ૧૯૯
વિઝા / રૂપે પ્લેટિનમ ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકાણ મોડેલ શુલ્ક)	રૂ. ૨૫૦
ELITE / વિઝા સિગ્નેચર ડેબિટ કાર્ડ (જારી, વાર્ષિક જાળવણી અને નવીકાણ મોડેલ શુલ્ક)	રૂ. ૬૦૦
કાર્ડ વડે વ્યવહારની સ્લિપની પુનઃપ્રાપ્તિના શુલ્ક (ખોટા દવાઓ માટે)	રૂ. ૨૫૦/- પ્રતિ સ્લિપ
સ્ટોપ પેમેન્ટ સિંગલ ચેક	રૂ. ૧૦૦ પ્રતિ ચેક
સ્ટોપ પેમેન્ટ સિરીઝ	૨૫ ચેકની સિરીઝ માટે રૂ. ૧૫૦
નાણાકીય કારણોસર આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	રૂ. ૭૫ પ્રતિ ચેક
નાણાકીય કારણોસર ઇનવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	૨ ચેક સુધી રૂ. ૫૦૦ થી, ત્રીજો ચેક રૂ. ૭૫૦/- થી
ટેકનિકલ કારણોસર ઇનવર્ડ / આઉટવર્ડ ચેક રીઝર્વના શુલ્ક	શૂન્ય
સ્થાયી સૂચનાઓ સેટ અપ/સુધારણા (RD/SIP/લિલ ચુકવણીઓ માટે મફત)	પ્રતિ વખત રૂ. ૨૫/-
સ્થાયી સૂચનાઓ નિષ્કળતા (રીઝર્વ)	પ્રતિ રિઝર્વ રૂ. ૧૫૦/-
નાણાકીય કારણોસર ECS/NACH રીઝર્વ	પ્રતિ રિઝર્વ રૂ. ૨૦૦/-

હું/અમે આથી પુષ્ટિ કરીએ છીએ કે મેં/અમે સ્ટાન્ડર્ડ સેવિંગ્સ એકાઉન્ટ માટેના શુલ્કનું સમયપત્રક વાંચ્યું અને સમજી લીધું છે.

૧ _____
(લિન-વ્યવસ્થાપક માટે સ્ટેમ્પ અને સહી)

૨ _____
(લિન-વ્યવસ્થાપક માટે સ્ટેમ્પ અને સહી)

SMS ચેતવણીઓ (ડેબિટ અને ક્રેડિટ વ્યવહારો)	પ્રતિ મહિને ૧૦ મફત જાનજ, ત્યારબાદ, પ્રતિ જાનજ ૩૦ પૈસા
ફોરેન એક્સચેન્જ માર્ક-અપ ^૧	૩.૫%
ટેકનિકલ કારણોસર આઉટપર્ક ચેક રિટર્નના શુલ્ક	શૂન્ય
પ્રમાણપત્ર અને રિપોર્ટ જારી કરવું	
શાખામાં બેલેન્સ પ્રમાણપત્ર (ઓનલાઈન મફત)	પ્રતિ વખત રૂ. ૨૫૦/-
પાછલા વર્ષની બેલેન્સ અને વ્યાજનું સ્ટેટમેન્ટ (ઓનલાઈન મફત)	પ્રતિ વર્ષે ૧ મફત, ત્યારબાદ પ્રતિ સ્ટેટમેન્ટ રૂ. ૩૦૦
પાસબુક જારી કરવી	મફત
ક્રુસિકેટ પાસબુક જારી કરવી	રૂ. ૫૦
સહીની ચકાસણી પ્રમાણપત્ર/ફોટો પ્રમાણિત/સરનામાની પુષ્ટિ	પ્રતિ વખત રૂ. ૫૦/-
ક્રુસિકેટ TDS પ્રમાણપત્ર	રૂ. ૧૦૦
ક્રુસિકેટ એક્સચેન્જ સ્ટેટમેન્ટ પ્રિન્ટ (મફત ઓનલાઈન અથવા ઇમેઇલ પર)	રૂ. ૫૦
DD/PO પુનઃમાન્યીકરણ/રદીકરણ	રૂ. ૧૦૦
ખાતું ખોલવાના ૧૫ દિવસ પછી અને ૬ મહિના પૂર્ણ થાય તે પહેલાં ગ્રાહકની વિનંતી પર ખાતું બંધ	રૂ. ૫૦૦
ખાતું નિષ્ક્રિય રહેવા પર શુલ્ક	શૂન્ય
ઁરરરરેખ ંર્ર્ર્ર્ર	
ચેક પિકઅપ	પ્રતિ વખત રૂ. ૫૦/-
કેસ પિકઅપ બીટ (દર મહિને)	રૂ. ૩૦૦
કેસ પિકઅપ બીટ (દર મહિને)	
રૂ. ૨,૦૦,૦૦૦ સુધી	રૂ. ૩૫૦૦
૨,૦૦,૦૦૦ થી ૫,૦૦,૦૦૦	રૂ. ૫૦૦૦
૫,૦૦,૦૦૦ થી ૧૦,૦૦,૦૦૦	રૂ. ૧૦૦૦૦
૧૦,૦૦,૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
કોલ પર કેસ પિકઅપ (દેક વખતે શુલ્ક)	
રૂ. ૨૦૦૦૦૦ સુધી	રૂ. ૧૫૦
૨૦૦૦૦૦ થી ૫૦૦,૦૦૦	રૂ. ૩૦૦
૫૦૦૦૦૦ થી ૧૦૦૦૦૦૦	રૂ. ૫૦૦
૧૦૦૦૦૦૦ થી ૨૦૦૦૦૦૦૦	રૂ. ૮૦૦
રૂ. ૨૦૦૦૦૦ થી વધુ	શાખાનો સંપર્ક કરો
વ્યવહારોની સંખ્યા	
ગ્રાહક દ્વારા કરવામાં આવેલા તમામ વ્યવહારોનું ંક્રમીકરણ જેમાં શામેલ છે:	
રોક/ચેક/ (ઓનલાઈન અને ંટ્રીએમ વડે થયેલ વ્યવહાર સિવાય)	દર મહિને ૫ વ્યવહારો સુધી મફત
મુક્ત મર્યાદાથી વધુ પર શુલ્ક	વ્યાક્રિતગત વ્યવહાર મર્યાદા ઉપરાંત પ્રતિ વ્યવહાર રૂ. ૧૫

^૧નાણાકીય વ્યવહાર તરીકે ગણવામાં આવતા અપૂરતા ભંડોળને કારણે રોક ઉપાડ નિષ્ફળ
^૨બેંકર્સ બેંક ડેબિટ કર્ડ ફક્ત બેંકર્સ બેંક ગ્રાહકોને જ જારી કરવામાં આવે છે, જો ગ્રાહક હવે બેંકર્સ બેંક પ્રોગ્રામ સ્ટેટ્સ ધરાવતા નથી તો રૂ. ૬૦૦ શુલ્ક લાગુ પડે છે.
(શુલ્ક ટળવા માટે રિપ્લેસમેન્ટ ડેબિટ કર્ડ માટે ક્રઅર ફેર/શાખાનો સંપર્ક કરો)

^૩ભારતીય ચલણમાં, આંતરરાષ્ટ્રીય સ્થાન પર અથવા ભારતમાં કાર્યરત પરંતુ વિદેશી રાષ્ટ્રમાં નોંધાયેલા વેપારીઓ સાથે ભારતીય ચલણમાં કરવામાં આવતા દેક આંતરરાષ્ટ્રીય વ્યવહાર પર ૩.૫% ફોરેક્સ માર્ક-અપ ફી (લાગુ પડતા ફેર) વસૂલવામાં આવશે. આ ઇઅજબ ખાતા હેઠળ જારી કરાયેલા તમામ ડેબિટ કર્ડ્સ માટે લાગુ પડે છે, સિવાય કે બેંકર્સ બેંક (માસ્ટકાર્ડ વર્લ્ડ) અને ગણુકા (વિઝા પ્લેટિનમ). નૂપા કરીને નોંધ લો કે બેંકની વિવેક્યુલેના આધારે આ સમયાંતરે બદલાઈ શકે છે.

^૪વિનંતી પર ફક્ત પસંદગીના સ્થળોએ ઉપલબ્ધ. લાગુ પડતા ફેર વધારાના રહેશે કમકમ પેયેબલ એટ પાર ગમ: લાગુ પડતું નથી જમ: સેવિંગ્સ એક્સચેન્જ ઇઅ: કન્ટ એક્સચેન્જ